



ધી ભાગ્યોદય કો. ઓપરેટીવ બેંક લિ.

રજી. અને એડમી ઓફિસ : નવા માધવપુરા, દિલ્હી દરવાજા પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૪.

ફોન : ૦૭૯-૨૨૧૩૮૨૩૫, ૨૨૧૩૭૪૮૮, ફેક્સ : ૦૭૯-૨૨૧૭૩૮૫૦

URL : www.bhagyodayabank.com

E-mail : tbcbl@dataone.in

ટર્મ / રીકરીંગ ડિપોઝીટ એકાઉન્ટ ઓપનીંગ ફોર્મ

શાખા _____ ઓફિસ ઉપયોગ માટે તારીખ :

D	D	M	M	2	0	Y	Y
---	---	---	---	---	---	---	---

ડિપોઝીટ / રીકરીંગ ખાતા નં. :

1	3	4																	
---	---	---	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

 જન્મ તા. _____

કેટેગરી : ☐ જનરલ ☐ સ્ટાફ ☐ સીનીયર સીટીઝન ☐ સગીર (જન્મ તારીખનો પુરાવો રજૂ કરવો- સગીર/સીનીયર સીટીઝન)

A હું / અમો નીચે સહી કરનાર આપની બેંકમાં ટર્મ ડિપોઝીટ / રીકરીંગ ડિપોઝીટ ખાતું ખોલાવવા માંગીએ છીએ.

૧. _____ CID No.: _____

૨. _____ CID No.: _____

૩. _____ CID No.: _____

B ખાતું ચલાવવા અંગેની સૂચના ☐ પોતે ☐ ગમે તે એક ☐ જોઈન્ટ ☐ અન્ય _____ (સ્પષ્ટતા કરવી)

C મોબાઈલ નંબર (૧) _____ (૨) _____ રહેઠાણ નં. _____

Email ID _____

D અરજદારના પાસપોર્ટ સાઈઝના ફોટા તથા સહી

પ્રથમ અરજદાર

બીજા અરજદાર

ત્રીજા અરજદાર

સહી : _____

પ્રથમ અરજદારની સહી

બીજા અરજદારની સહી

ત્રીજા અરજદારની સહી

E ટર્મ ડિપોઝીટ ડિપોઝીટ મુક્યા તારીખ _____ ડિપોઝીટની રકમ _____ ડિપોઝીટની મુદત _____

વ્યાજનો દર _____ પાકતી તા. _____ રેફ ખાતા નં. _____ ઓટો રીન્યુ ☐ હા ☐ ના

F માસિક/ત્રિમાસિક વ્યાજની સ્કીમમાં મુકેલ ડિપોઝીટનું વ્યાજ જો ખાતામાં જમા લેવાનું હોય તો ખાતા નં. _____

NEFT/RTGSની વિગત (ચેકની ઝેરોક્ષ રજૂ કરવી) IFSC કોડ નં. : _____

બેનીફિશિયરી એકાઉન્ટ નં. _____ બેનીફિશિયરનું નામ _____

બેંકનું નામ _____ શાખા _____

G TDS કપાત ☐ હા ☐ ના (જો TDS કપાત કરવાની ના હોય તો દર વર્ષે 15G / H ફોર્મ જમા કરાવવાનું રહેશે.)

H રીકરીંગ ડિપોઝીટ ખાતું ખોલ્યા તા. _____ મુદત _____ હપ્તાની રકમ _____

વ્યાજનો દર _____ પાકતી તારીખ _____ પાકતી રકમ _____ હપ્તાની તા. _____

રીકરીંગના હપ્તાની રકમ જો ખાતામાંથી ઉધાર કરવાની હોય તો એકાઉન્ટ નંબર _____

I નોમીનેશન ફોર્મ - DA-1

બેંક ડિપોઝીટમાં નોમીનેશન અન્વયે કલમ ૪૫૪A સાથે કલમ ૫૬ વંચાણે લેતાં અથવા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૮ અને નિયમ ૨ (૧) અથવા ધી કો-ઓપરેટીવ બેંકસ (નોમીનેશન) નિયમો ૧૯૮૫ મુજબ હું/અમો સદર ખાતા માટે નીચે જણાવેલ વ્યક્તિને નોમીની તરીકે નીમું છું / નીમીએ છીએ, જે મારા/અમારા/સગીરનાં મૃત્યુ પછી ડીપોઝીટની રકમ મેળવવાને માટે હક્કદાર છે.

નોમીનીનું નામ	સરનામું	ડીપોઝીટર સાથેનો સંબંધ જે હોય તે	નોમીની ની ઉંમર	★ જો નોમીની સગીર હોય તો તેની/તેણીની જન્મ તારીખ

- ★ નોમીનેશન તારીખે નોમીની સગીર હોઈ હું/અમો શ્રી _____ ને મારા / અમારા / સગીરના, નોમીનીના સગીરાવસ્થા દરમિયાન, મૃત્યુ થવાના પ્રસંગે નોમીની વતી થાપણની રકમ મેળવવા માટે નિયુક્ત કરૂં છું / કરીએ છીએ.
- ★ જો ડીપોઝીટ સગીરનાં નામે મુકેલ હોય તો નોમીનેશન સગીર વતી કાયદેસર કામ કરી શકે તેવી વ્યક્તિની સહી કરવી.
- ★ નોમીની સગીર ના હોય તો ચેકી નાંખવું.
- (૧) _____
- (૨) _____
- (૩) _____
- તા. : _____
- સ્થળ : _____ ડિપોઝીટરની સહી / અંગૂઠાનું નિશાન

જો અંગૂઠાનું નિશાન હોય તો બે સાક્ષીની સહી મેળવવી.

- (૧) સાક્ષીનું નામ : _____
- સરનામું : _____
- સહી : _____ તારીખ : _____ સ્થળ : _____
- (૨) સાક્ષીનું નામ : _____
- સરનામું : _____
- સહી : _____ તારીખ : _____ સ્થળ : _____

J ટર્મ ડિપોઝીટ તથા ઓટો રીન્યુના નિયમો તથા શરતો

- ડિપોઝીટ પાકતી તારીખ પહેલાં જો વટાવવા માંગતા હોય તો બેંકના નિયમ મુજબ પીનલ વ્યાજ કાપવામાં આવશે.
- ડિપોઝીટની રસીદ પાકતી તારીખથી ૧૪ દિવસની અંદર બેંકમાં રિન્યૂ માટે રજૂ કરવામાં આવશે તો **As on** કરવામાં આવશે. ત્યારબાદ રજૂ કરવામાં આવશે તો પાકતી તારીખ પછીના જે દિવસો / મુદત થતી હશે તેનું સેવિંગ્સ દર મુજબ વ્યાજ ચૂકવવામાં આવશે.
- માસિક/ત્રિમાસિક વ્યાજના દરની ડિપોઝીટ સ્કીમમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તથા બેંકના નિયમો મુજબ વ્યાજ ચૂકવવામાં આવશે.
- રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તથા બેંકના નિયમો અનુસાર વ્યાજના દરમાં વખતોવખત ફેરફાર કરાવતો બેંકને અધિકાર રહેશે.
- ઈન્કમેટેક્સના કાયદા મુજબ રૂા. ૧૦૦૦૦/- થી વધારે વ્યાજની આવક ઉપર બેંક **TDS** કાપી શકશે.
- ઈન્કમેટેક્સના કાયદા પ્રમાણે દરેક ડિપોઝીટરે પાન નં. આપવો જરૂરી છે. પાન નંબર નહિ હોય તો ૨૦% લેખે ટેક્સ કપાત થશે. જે ડિપોઝીટર **TDS** ના કપાવવા ઈચ્છતા હોય તેઓએ ફોર્મ નં. **15G/H** ડિપોઝીટ મૂકતાં સમયે તેમજ દરેક વર્ષે એપ્રિલ માસમાં ભરીને આપવાનું રહેશે. પાન નં. વગરનું **15G/H** અમાન્ય ગણાશે.
- જે ડિપોઝીટ જે કેટેગરીમાં મૂકવામાં આવેલ હશે તે કેટેગરીમાં જ ઓટો રિન્યૂ થઈ શકશે. કેટેગરી બદલવાના કિસ્સામાં ઓટો રિન્યૂ થઈ શકશે નહીં.
- ડિપોઝીટ પાકતી તારીખ બાદ ઓટો રિન્યૂ થઈ જશે પરંતુ ઓટો રિન્યૂ થયા બાદ ૧૪ દિવસની અંદર જો વટાવવામાં આવશે તો આવી રસીદ ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવામાં આવશે નહીં પણ જો ત્યારબાદ વટાવવામાં આવશે તો બેંકના નિયમ મુજબ પીનલ વ્યાજ કાપીને વ્યાજ ચૂકવવામાં આવશે. તેમજ રસીદ પાછળ દરેક ડિપોઝીટરની સહી કરાવવાની રહેશે.
- ડિપોઝીટરના અવસાન થવાના કિસ્સામાં/સગીરમાંથી પુત્ર/સીનીયર સિટીઝન થવાના કિસ્સામાં પાકતી તારીખે રસીદ બેંકમાં રજૂ કરવી ફરજિયાત રહેશે.
- જે ડિપોઝીટ જેટલી મુદત માટે મુકેલ હશે તેટલી મુદત માટે જ ઓટો રિન્યૂ થઈ શકશે. મુદતમાં ફેરફાર થઈ શકશે નહીં.
- TDS**ના કિસ્સામાં **TDS** કપાત બાદની રકમ રિન્યૂ કરવામાં આવશે.
- ડિપોઝીટ જે સ્કીમમાં મુકેલ હશે તે જ સ્કીમમાં રિન્યૂ થઈ શકશે.
- ઓટો રિન્યૂ થયેલ રસીદની સામે લોન / ઓવરડ્રાફ્ટ ફેસીલીટી માટે ઓટો રિન્યૂ ઓપ્શન “રીમુવ” કર્યા બાદ જ આવી રસીદનું લીયન થઈ શકશે અને લોન / ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ ખૂલી શકશે.
- જે ખાતેદારને જો ડિપોઝીટ ઓટો રિન્યૂ કરાવવી ના હોય તો પાકતી તારીખે ડિપોઝીટ રીસીપ્ટ બેંકમાં રજૂ કરીને વટાવવાની રહેશે.
- ડિપોઝીટરના અવસાન થવાના કિસ્સામાં જે કેટેગરીમાં ડિપોઝીટ મુકેલ હશે તે ડિપોઝીટનું વ્યાજ તેઓના અવસાન થવાની તારીખ સુધીનું જ તે કેટેગરીમાં મળશે તેમજ બાકીના પીરીયડનું વ્યાજ બીજા સંયુક્ત અરજદારના જે તે કેટેગરી મુજબ બેંક ચૂકવશે. જો કેટેગરીમાં ફેરફાર નહિ થતો હોય તો નિયમ મુજબ વ્યાજ ચૂકવવામાં આવશે.
- સગીરના કિસ્સામાં ડિપોઝીટ ઓટો રિન્યૂ થઈ શકશે નહીં.

પ્રથમ અરજદારની સહી

બીજા અરજદારની સહી

ત્રીજા અરજદારની સહી

K ઓફિસ ઉપયોગ માટે (A) પ્રમાણિત દસ્તાવેજ : ☐ સેલ્ફ સર્ટીફિકેટ ☐ ખરી નકલ ☐ નોટરી (B) રીસ્ક કેટેગરી : ☐ High ☐ Medium ☐ Low

તા. ના રોજ અરજદારના કેવાયસી અંગેની ઓરીજનલ પુરાવા સાથે ચકાસણી કરેલ છે.

(A) કોમ્પ્યુ. એન્ટ્રી કરનાર કલાર્કની સહી : _____ તારીખ : _____

(B) ચકાસણી અધિકારીની સહી : _____ પ્રાન્ય મેનેજર / એજન્ટની સહી : _____